

September 27, 2024

To,

BSE Limited National Stock Exchange of India Limited

Phiroze Jeejeebhoy Towers Exchange Plaza,

Dalal Street Bandra Kurla Complex,

Mumbai- 400001 Bandra (E), Mumbai - 400 051

Scrip Code: 532967 Scrip ID: KIRIINDUS

Dear Sir/Madam,

Sub: Newspaper Publication for Corrigendum to the Notice of the 26th Annual General Meeting.

With reference to the above captioned subject and in compliance with Regulation 30 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of Companies (Management and Administration) Rules, 2014, we submit herewith the copies of newspaper advertisements in respect of the Corrigendum to the Notice of the 26th Annual General Meeting of the Company as published in Jai Hind -Ahmedabad edition (Gujarati) and Financial Express - Mumbai edition (English) on Friday, September 27, 2024.

You are requested to kindly take note of the same.

Thanking you,

Yours faithfully,

For Kiri Industries Limited

Suresh Gondalia **Company Secretary** M. No.: F7306

Encl: As stated

DYES

Plot No: 299/1/A & B. Phase-II, Nr. Water Tank, GIDC, Vatva, hmedabad – 382 445, Gujarat, India. hone: +91-79-25994477 ax: +91-79-25834960 gmall: engage@kiriindustries.com Web: www.kiriindustries.com

INTERMEDIATES

INTERMEDIATES

INTERMEDIATES

Piot No: 396/399/403/404, EPC Canal Road, Village: Dudhwada, Tal.: Padra, Dist.: Vadodara - 391450. Gujarat, India.

Phone: +91-2662-273 444

Fax: +91-2662-273 444

Email: intermediates@kiriindustries.com

s@kiriindustries.com Web: www.kiriindustries.com

CHEMICALS

Plot No : 552-A, 566, 567, 569-71, Village : Dudhwada, Tal. : Padra, Dist. : Vadodara-391450 Gujarat, India. Phone: +91-2662-273724, 25 Fax: +91-2662-273726 Email : intermediates@kiriindustries.com Web : www.kiriindustries.com

REGISTERED OFFICE: 7th Floor, Hasubhai Chamber, Opp. Town Hall, Ellisbridge, Ahmedabad – 380 006. Gujarat (India). Phone: + 91-79-2657 4371-72-73 Fax: + 91-79-2657 4374

CIN No.: L24231GJ1998PLC034094

રેલવે ટ્રેક પર પાણી ભરાયા, શાળા-કોલેજો બંધ

મહારાષ્ટ્રના અનેક શહેરોમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ચિંતાજનક

મહારાષ્ટ્રના અનેક શહેરોમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ચિંતાજનેક છે. રસ્તાઓ મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક અને તેલંગાણાના ભાગોમાં છુટાછવાયા સ્થળોએ પણ ભારે

પર પાણી ભરાઈ જવાને કારણે 📱 જનજીવન ખરાબ રીતે

ભારે વરસાદને કારણે પુના પ્રવાસ રદ્

નવી દિલ્હી, તા.૨૬ મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે પુના સહિતનો પ્રવાસ રદ કરવામાં^{*} આવ્યો હતો. રાજ્યમાં ગઇકાલ રાતથી ભારે વરસાદ શરુ થયો હતો. મોદીએ આજે પુનામાં મેટ્રો ટ્રેનમાં લોકાર્પણમાં આવવાના હતા. રૂા.૨૨૬૦૦ના આ પ્રોજેક્ટ માટેની તમામ તૈયારીઓ થઇ ગઇ હતી. પરંતુ વરસાદને કારણે પુનામાં પણ માર્ગો પાણી…પાણી થઇ ગયા હતા. વડાપ્રધાનનો પ્રવાસ રદ

દ્વારા આપવામાં આવેલી

કોંકણ અને ગોવા, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ અને યાનમ, પૂર્વ મધ્ય પ્રદેશ, ઉપ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. બિહાર શક્ય છે. રાયલસીમા, પણ વાહનો અવરજવર કરતા હતા.

મુંબઈ, તા.૨૬ | ગુજરાત પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ મધ્યપ્રદેશ, ગંગાજળ પશ્ચિમ બંગાળ, ઓડિશા,

|વરસાદની અપેક્ષા છે. ખરાબ હવામાનના કારણે અકસ્માતમાં એક મહિલાના મોતના સમાચાર મુંબઈમાં પણ સામે આવ્યા છે. અંધેરીના MIDC વિસ્તારમાં ખુલ્લી ગટરમાં 45 વર્ષીય વિમલ ગાયકવાડનું ડૂબી જવાથી મોત થયું હતું. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોપીરેશન અધિકારીઓએ જણાવ્યું હતું કે મુંબઈ ફાયર બ્રિગેડે તેને બહાર કાઢી કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. મુશળધાર વરસાદને કારણે ગોવંડી-માનખુઈ વચ્ચે દોડતી

શાળા-કોલેજો બંધરાખવાનો નિર્ણય લેવામાં આવ્યો | અધિકારી (CPRO)એ જણાવ્યું હતું કે પાટા પરનું પાણી ઓછુ થયા બાદ હાર્બર લાઇન લોકલ ટ્રેનોએ ફરી સેવા શરૂ કરી હતી. તેમણે કહ્યું કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ટ્રેનોને સાવધાની સાથે ચલાવવામાં આવી રહી છે. ઝડપ મહત્તમ 25

લગભગ 11.30 વાગ્યે મુંબ્રા બાયપાસ પર ભૂસ્ખલન થયું હતું. મુંબઈના કુલી ઈસ્ટ,

મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે દુર્ઘટના

મુંબઈમાં ૨૫ સપ્ટેમ્બરની સાંજે અચાનક શરૂ થયેલા ભારે વરસાદે તબાહી મચાવી હતી. ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયાં હતાં અને વાહન-વ્યવહાર ખોરવાઈ ગયું હતું. બીજી બાજું BMC ની બેદરકારીના કારણે અંધેરી

ઘટનાની જાણકારી મળતાં જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીં કહેવાયું કે, તમારા એક મહિલાની તપાસ કરી. જોકે, મોડી રાત્રે રેસ્ક્યુ ટીમને મહિલાનો મૃતદેહ મળ્યો હતો.

મોડી રાત્રે લગભગ ૧૧:૩૦ વાગ્યે લગાવાયું ન હતું.

પોલીસનો ફોન આવ્યો. વ પરિજનનની મોત થઈ ગઈ છે. આ અકસ્માત ખૂબ જ દુઃખદ છે. અમે ફરિયાદ નોંધાવી છે. આ મૃતક મહિલાની પિતરાઇ બહેન બીએમસીની ઘોર બેદરકારી છે, ઉષા સાબલેએ જણાવ્યું કે, અમને કારણકે ત્યાં કોઈ સાઇન બોર્ડ

BMC ની બેદરકારીના કારણે મહિલાનો જીવ ગયો

વિસ્તારમાં ગટરમાં પડવાથી એક મહિલાનું મોત નિપજ્યું છે. મૃતક મહિલાના પતિ બીએમસીની સામે **ફરિયાદ કરવા એમઆઈડીસી** પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. અંધેરીમાં ગટરમાં પડીને મહિલાની મોતને લઈને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, મહિલા ઘરેથી કામ માટે બહાર જઈ રહી હતી. આ દરમિયાન ભારે વરસાદ પણ વરસી રહ્યો હતો અને ચોતરફ પાણી ભરાયેલા હતાં. એ જ રસ્તા પર વચ્ચે ખુલ્લી ગટર હતી અને મહિલા અચાનક તેમાં પડી ગઈ.

૭૧ બિલિયન ડોલરથી વધનો વધારો

થયો છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં

૧૬.૭ અંબજ ડોલર અને ગૌતમ

અદાણીની સંપત્તિમાં ૨૦.૯ અબજ

ડોલરનો વધારો થયો છે. આ યાદીમાં

અંબાણી ૧૨ મા અને અદાણી ૧૫

મા નંબરે છે. એનવીડિયા ના સીઈઓ

જેન્સન સંપત્તિ વધારાનાં મામલે બીજા

સ્થાને છે. તેમની સંપત્તિમાં ૬૧.૮

બિલિયન ડોલરનો વધારો થયો હતો.

જાહેર સુચના ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ (B.P.C.L) કંપની ભારતીય કંપની

અધિનિયમ ૧૯૧૩ હેઠળ સમાવિષ્ટ થાવાનો ઈરોદો ધરાવે છે. જે ૨૨ બાય ૪૩ મીટર યાને ૯૪૬ ચોરસ મીટર ખાલી પડેલ બીનખેતીની જમીન ભાડા પેટે રાખે છે જેનો રેવન્યુ સર્વે નં. ૪૯૨/૩, મોજે ગામ થલતેજ, તાલુકા ઘાટલોડીયા, જી. અમદાવાદ, ગુજરાત ખાતે આવેલ છે તેમના સંયુક્ત માલિક ટાઈટલ હોલ્ડર હરેશભાઈ બુધાભાઈ બારોટ તથા શૈલેષભાઈ બુધાભાઈ બારોટ ના એ ૧૯ વર્ષ ૧૧ મહિનાના સમયગાળા માટે ભાડા પેટે આપે છે. જેની સીમાઓ પૂર્વે : સર્વે નં. ૪૯૨/૩ ની બાકીની જમીન આવેલ છે. પશ્ચિમે : જાહેર રોડ આવેલ છે. ઉત્તરે : સર્વે નં. ૪૯૩ ની જમીન આવેલ છે. દક્ષિણ : સર્વે નં. ૪૯૨/૩ નો ખાનગી રોડ આવેલ છે. હરેશભાઈ બુધાભાઈ બારોટ તથા શૈલેષભાઈ બુધાબાઈ બારોટ સિવાય અન્ય કોઈ વ્યક્તિ આ મિલ્કત ઉપર કોઈપણ રીતે લક્ક કે દાવો ધરાવે છે તો તેની જાણ આજથી (પ્રકાશનની તારીખ) થી ૭ દિવસમાં નીચેના સરનામે

દેરીટરી મેનેજર (રીટેલ), બી.પી.સી.એલ., પહેલો માળ, ગોલ્ડન ટ્રાચએન્ગલ, નવજીવન, પોષ્ટ બોક્ષ નં. ૦૬, અમદાવાદ-૩૮૦૦૧૪.

पंजाब नैशनल बैंक ⊌ punjabnational bank

પરિશિષ્ટ-IV, [અંતર્ગત નિયમ ૮(૧)] કબજા નોટીસ (સ્થાયી મિલકત માટે) આથી નિમ્નનિર્દિષ્ટ **પંજાબ નેશનલ બેંક**, ના અધિકૃત અધિકારીએ સરફેર્સ એક્ટ–૨૦૦૨ હેઠળ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ–૨૦૦૨ ની સત્તાની રૂએ કલમ ૧૩(૧૨) સાથે વંચાતા રૂલ ૩, સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્કોર્સમેન્ટ) રૂલ્ટ ૨૦૦૨ હેઠળ જણાવેલ કાયદાની કલમ ૧૩(૨) અંતર્ગત **તા. ૧૯.૦૯.૨૦૨**૪ ના રોવ માંગણા નોટીસ મોકલી કરજદાર/જામીનદાર/ગીરોદાર શ્રીમતી વિજયલસ્મી **भेरपानवर अने शीव३८पा भैरपानवरने** मांगणा नोटीस लरी डरीने **३**1. ૩૨,૫૩,૪૦૦.७૩ (અંકે રૂા. બત્રીસ લાખ ત્રેપન હજાર ચારસો અને તોંતેર પૈસા પુરા) માતા. નં. ૦૧૨૦૬૦૧૧૦૦૦હલ્ં ના સંદર્ભમાં તા. ૧૯.૦૯.૨૦૨૪ સુધી સાથે સંપુષ્ટ ચૂક્વણી ન થાય ત્યાં સુધીનું આગળનું વ્યાજ અને ખર્ચાઓ આ નોટીસની તારીખ

નોટીસ મળ્યાની તારીખથી ચુકવવા માટે જણાવેલ હતું. કરજદારો/જામીનદારો/ગીરોદારો રકમ ચુકવવામાં નિષ્ફળ ગયા હોઈ, આથી કરજદારો/જામીનદારો/ગીરોદારો અને આમજનતાને નોટીસ આપી જણાવવામ આવે છે કે નીચે સહી કરનારે જણાવેલ કાયદાની કલમ ૧૩(૪) સાથે જણાવેલ નિયમો વાંચતા સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ નિયમ ૨૦૦૨ના નિયમ ૮ હેઠળ તેમને મળેલી સત્તાની રૂએ નીચે જણાવેલ મિલક્તનો **તા. ૨૪.૦૯.૨૦૨૪** ના રોવ સાંકેતિક કબજો લઇ લીધેલ છે.

તારણમાં મુકેલ મિલકતને છોડાવવા માટે ઉપલબ્ધ સમયના સંદર્ભમાં કાયદાની કલર ાં 3ની પેટા કલમ (૮)ની જોગવાઈ અનુસાર કરજદારોનું ધ્યાન દોરવામાં આવે છે.

આથી ખાસ કરીને કરજદારો/જામીનદારો/ગીરોદારો અને જાહેર જનતાન ચેતવણી આપવામાં આવે છે કે નીચે જણાવેલ મિલકતનો સોદો કે વેચાણને લગર્ત डार्थवाही डरवी नहीं अने डोर्धपए। प्रકारनो व्यवहार डरेल हशे तो ते **पंज**ठ નેશનલ બેંક નાં રૂા. ૩૨,૫૩,૪૦૦.७૩ (અંકે રૂા. બત્રીસ લાખ ત્રેપન હજાર ચારસે અને તોંતેર પૈસા પુરા) ખાતા. નં. ૦૧૨૦૬૦૧૧૦૦૦૯૯ના સંદર્ભમાં તા ૧७.૦७.૨૦૨૪ સુધી સાથે સંપુર્ણ ચૂક્વણી ન થાય ત્યાં સુધીનું આગળનું વ્યાજ અને ખર્ચાઓને આધીન રહેશે.

स्थायी भिसङतमुं वर्णन

રહેણાંક ફલેટ નં. એ/૩૦૨, ક્ષેત્રફળ દૃ૪.૪૧ ચો.મી. બીલ્ટઅપ એરીયા, ત્રીજા માળે સ્ક્રીમ સંગાય બ્લીઝ થી જાણતી, બાંધકામ સર્વે નં. ૧૩૩/૧ ભાગની જમીન ઉપર ટાઉન પ્લાનીંગ સ્કીમ નં. ૨, ફાઈનલ પ્લોટ નં. ૫૪ મૌજે કોબા, તાલુકા ગાંધીનગર રજીસ્ટ્રેશન જીલ્લો અને પેટા જીલ્લો ગાંધીનગર, ગુજરાત રાજ્ય ખાતે આવેલ મિલકતનો તમામ ભાગ અને હીસ્સો. **માલિકીઃ શ્રીમતી વિજયલસ્મી ભૈરપ્પાનવ**ર **અને શીવરૂદ્રષ્પા ભેરપ્પાનવર** ચતુર્સીમાઃ પૂર્વઃ સોસાચટી રોડ, પશ્ચિમઃ પેસેજ તે પછી ફલેટ નં. એ-303, ઉત્તર: ફલેટ નં. એ-309, દક્ષિણ: રોડ.

તા. ૨૪.૦૯.૨૦૨૪, સ્થળઃ અમદાવાદ સહી/- અધિકૃત અધિકારી, પંજાબ નેશનલ બેં

કરવામાં આવ્યો હતો. છે. મુંબઈ પોલીસે લોકોને સતર્ક મુંબઈ પોલીસે લોકોને સતર્ક રહેવા અને હવામાન વિભાગ દ્વારા રહેવા અને હવામાન વિભાગ આપવામાં આવેલી ચેતવણીને ગંભીરતાથી લેવાની અપીલ કરી છે ચેતવણીને ગંભીરતાથી લેવાની અપીલ કરી છે. રેલવે કામગીરીને પણ અસર થઈ 🛭 કિમી પ્રતિ કલાક સુધી મર્યાદિત છે. બુધવારે મુંબઈમાં મુશળધાર વરસાદ બાદ શહેરના

છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના રાયગઢ, રત્નાગીરી ઉપરાંત વિશા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. રાત્રે હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, મરાઠવાડા, કોસ્ટલ કર્જાાટકમાં અલગ- | નેહરૂ નગર, ચેમ્બુરમાં પર્ણ પાણી ભરાયાની તસવીરો જોવા મળી હતી. કુર્લા બ્રિજ પર

પ્રભાવિત થયું છે. પુણે અને પિંપરી ચિંચવડમાં નુંબઈ લોકલ ટ્રેનોના સંચાલનને પણ અસર થઈ હતી. મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક

સુપ્રીમ કોર્ટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના સંબંધિત અધિકારીને જવાબ આપવા માટે સમન્સ પાઠવ્યું

જસ્ટિસ એએસ છે.

ટ્રાન્ઝેક્શન દ્વારા ૪૦૦૦ કરોડથી

વેચાયેલા શેરનું મૂલ્ય ૧ લાખ કરોડને

વટાવી ચૂક્યું છે. તે ૨૦૨૩ માં બમણાં

કરતાં વધારે છે, આ રકમ ૨૦૨૩ માં

૨૦૨૨ માં, સંખ્યા અનુક્રમે

પ૪૫૦૦ કરોડ અને ૨૫૪૦૦ કરોડ શેર્સ વેચ્યાં હતાં

પ્રમોટરો દ્વારા સેકન્ડરી માર્કેટમાં

વધુના સ્ટોકનું વેચાણ કર્યું છે.

અધિકારી સામે પગલાં લેવાની જરૂર

રૂા. ૪૦,૦૦૦ કરોડના શેર

સપ્ટેમ્બરના ત્રિમાસિકગાળામાં ડીએલએમ, શારદા મોટર ઈન્ડસ્ટ્રીઝ વ્યાજબી કિંમતનાં લાગે છે, ત્યારે

અત્યાર સુધીમાં લગભગ ૧૮૦ જેવી કંપનીઓના પ્રમોટર્સ ૧ જુલાઈ મિડ-કેપ સ્પેસમાં થોડી માત્રામાં ફ્રોથ

બજારમાં તેજી

સાથે, પ્રમોટરો

માટે નફો બુક

બીએસઈઅને એનએસઈના ડેટા સીઈઓ ફિરોઝ અઝીઝે જણાવ્યું હતું દેવું ચૂકવવા માટે ૧૨૧૮ કરોડમાં

અનુસાર, ઈન્ટરગ્લોબ એવિએશન, કે, 'બજારમાં તેજી સાથે, પ્રમોટરો ૩.૧૯ ટકા હિસ્સો વેચ્યો હતો.

અંબુજા સિમેન્ટ્સ, પતંજલિ ફૂડ્સ, માટે નફો બુક કરવાનું સામાન્ય છે વેલસ્પન લિવિંગના પ્રમોટરે ઓપન

મેકસ ફાઈનાન્સિયલ સર્વિસિસ, કારણ કે તેઓ આને સારા સમય માર્કેટટ્રાન્ઝેક્શનદ્વારા ૧૦૩૫ કરોડમાં

કેપીઆર મિલ્સ, ઈઝી ટ્રીપ પ્લાનર્સ, તરીકે જુએ છે તેમણે કહ્યું કે જ્યારે ૪૯.૮ મિલિયન શેર વેચ્યાં હતાં.

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં બે થી ત્રણ

જેટલી કંપનીઓએ ઓપન માર્કેટ થી ૩૦૦ કરોડથી ૧૦૫૦૦ કરોડના

૪૮૦૦૦ કરોડ હતી. ૨૦૨૧ અને કરવાનું સામાન્ય છે

માટે ઉપયોગ થતો હોય તેવી પ્રોપર્ટીને પાઠ વ્યાં છે. ભૂરે લાલાની રૂપિયા બાકી છે. આ સિવાય ગયાં કારણ કે આ તેની આવક નથી પરંત્ સીલ કરવા અંગે સપ્રીમ કોર્ટે બનાવેલી અધ્યક્ષતામાં સપ્રીમ કોર્ટે સીલિંગને મહિને સમિતિએ ૩.૫ કરોડ આ તમામ નાણાં કોર્ટ રજિસ્ટ્રીમાં મોનિટરિંગ કમિટીને ટેક્સ નોટિસ લઈને આપવામાં આવેલાં આદેશો પર રૂપિયાની રકમ સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીમાં મોકલવામાં આવે છે. રજિસ્ટ્રી તેને મોકલવાના મામલે કોર્ટે ઇન્કમ ટેક્સ નજર રાખવા માટે આ સમિતિની ટ્રાન્સફર કરી હતી. ૨૨ ઓગસ્ટે ડિપાર્ટમેન્ટ પાસે જવાબ માંગ્યો છે. રચના કરી હતી. બેન્ચમાં સામેલ આપેલાં આદેશમાં સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટે આ પ્રકારની કાર્યવાહી જસ્ટિસ પંકજ મિથલે કહ્યું કે સમિતિને ૧ સપ્ટેમ્બર ૨૦૨૪ પછી કોર્ટમાં રજૂ કર્યો અને કહ્યું કે આવકવેરા માટે સંબંધિત અધિકારીને જવાબ આવકવેરા વિભાગની આવી કાર્યવાહી દર ત્રણ મહિને કોર્ટમાં પ્રોસેસિંગ ફી વિભાગે હજુ સુધી નોટિસ પાછી આપવા માટે સમન્સ પણ પાઠવ્યું અપવાદ છે. તેમણે કહ્યું કે સંબંધિત જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. ખેંચી નથી. તેનાં જવાબમાં કુમારે બેંચને કહ્યું કે

આ કેસની આગામી અત્યાર સુધી સમિતિને ત્રણ વખત ઓકાની અધ્યક્ષતાવાળી બેન્ચે ત્રણ સનાવણી ૩૦ સપ્ટેમ્બરે થવાની છે. આઈટી નોટિસ મળી છે. સમિતિએ

હોય છે.'ઇન્ટરગ્લોબ એવિએશનના

પ્રમોટર રાકેશ ગંગવાલ અને તેમનાં

ફેમિલી ટ્રસ્ટે આશરે ૧૦૫૦૦ કરોડમાં

૫.૮૩ ટકા હિસ્સો વેચ્યો હતો.

ઓગસ્ટમાં, અદાણીઓએ ગ્રુપ કંપની

અંબુજા સિમેન્ટનો આશરે ૨.૮ ટકા

હિસ્સો ૪૨૦૦ કરોડમાં વેચ્યો હતો.

પતંજલિ ફૂડ્સના પ્રમોટર્સે ૨૦૧૬ કરોડમાં ૧૦.૮ મિલિયન શેર વેચ્યાં

હતાં. મેકસ ફાઇનાન્શિયલ

આનંદ રાઠી વેલ્થના ડેપ્યુટી સર્વિસિસના પ્રમોટર એન્ટિટીએ તેનું

નવી દિલ્હી.તા.૨૬ સભ્યોની મોનિટરિંગ કમિટીના વરિષ્ઠ વકીલ ગુરૂ કૃષ્ણ કુમારે કોર્ટને વિભાગને એવો જવાબ પણ આપ્ય રહેણાંક જગ્યાનો બિઝનેસ રિપોર્ટના આધારે અધિકારીને સમન્સ જણાવ્યું કે સમિતિ પાસે ૪૮૮૬૩ છે કે રિટર્ન ફાઈલ કરવાની જરૂર નથી ફિક્સ ડિપોઝિટ ખાતામાં રાખે છે. કુમારે કમિટીએ લખેલાં પત્રને પણ સમિતિએ કહ્યું હતું કે કલમ ૧૩૩ (૬) હેઠળ જારી કરાયેલી નોટિસ સ્વીકાર્ય નથી. આ તમામ ફંડ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ જમા કરવામાં રોકાણકારો કમાણી કરે કે ગુમાવે પણ પ્રમોટરોને ઘી-કેળા આવે છે અને કોર્ટમાં જ પરત કરવામાં આવે છે. આ કમિટીની રચના સુપ્રીમ કોર્ટે ૨૪ માર્ચ ૨૦૦૬ ના રોજ કરી ૧૮૦ કંપનીઓના પ્રમોટરોએ તેજીનો લાભ હતી

માર્ક ઝકરબર્ગ વિશ્વનાં ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બન્યાં નવી દિલ્હી.તા.૨૬ અબજોપતિઓની યાદી અનુસાર, આ મેટા પ્લેટફોર્મ્સના કો-ફાઉન્ડર વર્ષે અત્યાર સુધીમાં એલોન મસ્કની અને સીઈઓ માર્ક ઝકરબર્ગ વિશ્વનાં સંપત્તિમાં ૩૮.૯ ટકાનો વધારો થયો ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયાં છે. જેફ બેઝોસની સંપત્તિના ૩૯.૩

છે. ઝકરબર્ગ ૨૦૦ બિલિયન ડોલર ટકા અને માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં એટલે કે ૧૬.૭૩ લાખ કરોડની ક્લબમાં સામેલ થયાં છે. બ્લુમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, આ કલબમાં પહેલાં સ્થાન પર ટેસ્લા અને એક્સના માલિક એલોન મસ્ક છે. તેમની કુલ સંપત્તિ ૨૬૮ અબજ ડોલર છે. બીજા નંબરે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ છે. તેમની કુલ સંપત્તિ ૨૧૬ અબજ ડોલર છે. માહિતી અનુસાર, લુઈસ વિટનના ચેરમેન બર્નાર્ડ આર્નોલ્ટ ૨૦૦ બિલિયન ડોલરની સંપત્તિ ક્લબમાં સામેલ થવાથી થોડા જ દૂર છે. તેમની પાસે ૧૮૩ બિલિયન ડોલરની સંપત્તિ

ગઈકાલે બ્લમબર્ગ ઈન્ડેક્સ દ્વારા જાહેર કરવામાં આવેલી

અમો નીચે સહી કરનાર **શેરોન અનુપમા ગીબીચોન** તે આ જાહેરાતથી જાહેર જનતાને જણાવીએ છીએ કે, નીલુ એપાર્ટમેન્ટ, પ્રિતીકુંજ સોસાચટી સામે, રોમન કેથલીક ચર્ચ, ઇંડલી ચાર રસ્તા, મણીનગર પૂર્વ, ખોખરા, અમદાવાદ ખાતે આવેલ કલેટ નં. ૧૫ વાળી મિલકત ગીબીચોન એબનએઝર શેરોન અને ઝરીન ગીબીચોન શેરોન પાસેથી અમોને રજી. બક્ષીસ દસ્તાવેજ નં.૩૪૪७/૨૦૧૬ કરી બક્ષીસમાં આપવામાં આવેલ છે. સદરહ મિલકતનું શેર સર્ટીક્કિટ નં. ૧૧, બક નં.૧, શેર નંબર ૫૧ થી ૫૫ એમ કુલ ou શેરવાળુ અસલ સર્ટીફિકેટ અમારાથી કયાંક ખોવાઈ ગયેલ છે અને અમોએ ડુપ્લીકેટ શેર સર્ટીફિકેટ મેળવવા સોસાયટીમાં કાર્યવાહી કરેલ છે. જેથી કોઈને પણ ખોવાયેલ શેર સર્ટીફિકેટ મળે તો દિન-૭માં અમોને તે અંગેની જાણ કરશો નહિંતર સોસાયટી અમોને ડુપ્લીકેટ શેર સર્ટીફિકેટ ઈસ્યુ કરશે ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહિ.

ਗ਼ਵੀਅ: 27-09-2024

- શેરોન અનુપમા ગીબીચોન



Future Full of Colours

(CIN-L24231GJ1998PLC034094) રજીસ્ટર્ડ ઓફીસઃ ૭મો માળે, હસુભાઈ ચેમ્બર્સ, ટાઉનહોલ સામે, એલિસબ્રિજ, અમદાવાદ ૩૮૦ ૦૦*૬* સંપર્ક નં.: (પી) +૯૧ ૭૯ - ૨૬૫૭૪૪૩૭૧/૭૨/૭૩, ફેક્સઃ +૯૧ ૭૯ - ૨૬૫૭૪૩૭૪ ઈમેઈલ આઈડી: info@kiriindustries.com; વેબસાઇટ: www.kiriindustries

પેટ્રોલ-ડીઝલના સસ્તા થવા અંગે આવ્યા મોટા અપડેટ

કીરી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (''કંપની'') એ સભ્યોની ૨૬મી વાર્ષિક સામાન્ય સભા (''એજીએમ'') જે શુક્રવાર, સપ્ટેમ્બર ૨૭, ૨૦૨૪ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે, વીડિયો કોન્ફરન્સની સુવિધા મારફત યોજાનારી છે, તેની નોટિસ સપ્ટેમ્બર ૦૪, ૨૦૨૪ના રોજ કંપની ધારા ૨૦૧૩ની જોગવાઈના પાલન અર્થે જારી કરી હતી.

કંપની આ કોરીજેન્ડમ નોટિસ મારફતે સભ્યોને, આ નોટિસના આઈટમ

આ કોરીજેન્ડમ નોટિસ, એજીએમની નોટિસ તા.ઓગસ્ટ, ૨૯, ૨૦૨૪નો જ એક અભિન્ન ભાગ રહેશે, જે કંપનીના સભ્યોને પહેલા પ્રસારિત કરવામાં આવી હતી. એજીમની નોટિસ, આ તારીખથી અને ત્યારથી, હંમેશા આ કોરીજેન્ડમ નોટિસની સાથે વાંચવામાં આવશે. કોરીજેન્ડમ નોટિસમાં જણાવેલ વિગતોને છોડીને, એજીએમ નોટીસની બીજી બધી શરતો અને વિગતો યથાવત

કોરીજેન્ડમ નોટિસ કંપનીની વેબસાઈટ <u>www.kiriindustries.com</u>, કીરી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ વતી

તારીખ : સપ્ટેમ્બર ૨૬, ૨૦૨૪ સ્થળ : અમદાવાદ

સુરેશ ગોંડલીયા કંપની સેક્રેટરી

આધાર હાઉસિંગ કાયનાન્સ લી.

કોર્પોરેટ ઓફીસઃ યુનિટ નં. ૮૦૨, નટરાજ રૂસતમજી, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને એમ.વી. રોડ, અંધેરી(પૂર્વ), મુંબઈ-૪૦૦૦૬૮, મહારાષ્ટ્ર અમદાવાદ શાખાઃ ૩૦૧,ત્રીજા માળે, એબીસી-૩, હોટેલ રીજેંટા સામે, ગિરીશ કોલર્ડ્રિક પાસે, ઉમાશંકર જોશી માર્ગ,

ઑફ સી.જી.રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯, (ગુજરાત)

પરિશિષ્ટ ૪ કબજાની નોટીસ (સ્થાવર મિલકત માટે)

અહી નીચે સહી કરનાર સિક્થુરાઇટેઝેશન એન્ડ રિકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, .૦૦૨ હેઠળ આધાર હાઉસીંગ ફાયનાન્સ લીમીટેડ (એએચએફએલ)ના અધિકૃત અધિકારી હોવાથી અને સિક્યુરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ ૨૦૦૨ના નિયમ ૩ સાથે વંચાણે લેતા ઉક્ત એક્ટની કલમ ૧૩(૧૨) હેઠળ આપવામાં આવેલી સત્તાનો અમલ કરતા, અહી નીચે જણાવેલ રધારકર્તા(ઓ)/જામીનદાર(રો)ને અધિકૃત અધિકારી દ્વારા ડીમાંડ નોટીસ આપવામાં આવી હતી અને આ નોટીસમાં જણાવેલી રકમ કથિત નોટીસની ષાપ્તિની તારીખથી ૬૦ દિવસની અંદર ચૂંકવી આપવાની સૂચના આપવામાં આવી હતી. ઉધારકર્તા રકમ ચુકવવામાં નિષ્ફળ ગયા હોવાથી, આ દ્વારા ઉધારકર્તા(ઓ)∣જામીનદાર(રો)ને તથા સામાન્ય જનતાને નોટીસ આપવામાં આવે છે કે સિક્યુરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ ૨૦૦૨ના નિયમ ૮ સાથે વંચાણે લેતા કથિત એક્ટની કલમ ૧૩ની પેટા-કલમ (૪) હેઠળ આપવામાં આવેલી સત્તાની રુએ અહી નીચે સહી કરનાર અધિકારીએ, નીચે વર્શન કર્યા મુજબની મિલકતનો કબજો ધારણ કરેલ છે. જામીનકૃત મિલકતને પુનઃપ્રાપ્ત કરવા માટે પ્રાપ્ય સમયના સંદર્ભમાં કથિત એક્ટની કલમ ૧૩ની પેટાકલમ (૮)ની જોગવાઈઓ પ્રત્યે ઉધારકર્તાઓનું ધ્યાન દોરવામાં આવે છે. વિશિષ્ટ રૂપે ઉધારકર્તાને અને સામાન્યરીતે જાહેર ૪નતાને આ મીલકત અંગે કોઈ વ્યવહાર નહી કરવા આથી સુચના આપવામાં આવે છે અને મિલકત અંગેનો કોઈપણ વ્યવહાર, અહી નીચે જણાવેલી ૨કમ અને તેની ઉપરના વ્યાજ સાથેની ૨કમ માટે, એએચએફએલના પ્રભારને આધીન રહેશે.

ш	ર્ક મ	3 0 3 0 3 0 1 0 3 0 3 0 3 0 0 1 0 0 0 0	જામીનગીરી કૃત મિલકતનું વર્ણન (સ્થાવર મિલકત)	ડીમાંડ નોટીસની તારીખ અને રકમ	કબજાની તારીખ
	٩	(લોન કોડ નં. ૦૩૫૦૦૦૦૧૮૮/ અમદાવાદ શાખા) દલપતસિંહ કાળુસિંહ રાઠોડ (કરજદાર) હેતલબા દલપતસિંહ રાઠોડ (સહ-કરજદાર)	એનએ પંચાયત આકારણી નં. ૨૫૨ ઈન્દીરા આવાસ સોસાયટી પ્રાયમરી સ્કૂલ પાસે પોસ્ટ અમરપુત્ર પ્રાંતિજ સાબરકાંઠા ગુજરાત- ૩૮૩૨૦૫ ધરાવતી સુવાંગ મિલકત. ચતુર્દીશાઃ પૂર્વઃ રસ્તો, પશ્ચિમઃ રસ્તો, ઉત્તરઃ સંજયસિંહ સુરસિંહ ઝાલાના મકાન, દક્ષિણઃ માનસિંહ હરિસિંહ ઝાલાના મકાન.	10-06-2024 ₹ 6,42,623/-	26-09-2024
	સ્થળઃ ગુજરાત અધિકૃત અધિઃ તારીખઃ ૨૭.૦૯.૨૦૨૪ આધાર હાઉસીંગ ફાયનાન્સ લીર્મ				ાધિકૃત અધિકારી યનાન્સ લીમીટેડ

THOFC BANK

એચડીએક્સી બેન્ક લિમિટેડ

એચડીએફસી હાઉસ, મીઠાખળી છ રસ્તા પાસે, નવરંગપુરા, અમદાવાદ. ફોન : (૦७૯) દૃદ્દ3૦७૦૦૦

એચડીએફસી બેન્ક લિમિટેકના (ભૂતકાળમાં એચડીએફસી લિ., જેનું નામદાર એનસીએલટી-મુંબઇ ના તારીખ ૧૭ માર્ચ, ૨૦૨૩ ના આદેશ મુજબ મંજૂર થયેલ એકીકરણ યોજના અનુસાર **એચડીએફસી બેન્ક લિમિટેડ** સાથે એકીકરણ થયેલ છે) **(એચડીએફસી)** અધિકૃત અધિકારીઓને સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ કલમ ૧૩(૧૨), સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ ના રૂલ ૩ સાથે વાંચતા સત્તાને આધિન રહી ઉપરોક્ત એક્ટની કલમ ૧૩(૨) હેઠળ નીચેના બોરોઅર/કાયદેસરના વારસ(સો) અને કાયદેસરના પ્રતિનિધિ(ઓ)ને ડિમાન્ડ નોટિસ પાઠવવામાં આવેલ, જે અનુસાર તેમના જે તે નામ સામે દર્શાવેલ રકમ સહિત નોટિસમાં દર્શાવાયેલ તે રકમ ઉપરનું વ્યાજ, નોટિસ તારીખથી 🗲 દિવસમાં ચૂકવી આપવા જજ્ઞાવાયેલ છે. જે મુજબ પ્રાસંગિક ખર્ચા, અન્ય ખર્ચા, ચાર્જિસ વગેરે ચૂકવી અને/અથવા જમા થાય ત્યાં સુધીના આપવાના રહેશે.

रानु. नं.	બોરોઅર/કાયદેસરનાં વારસદાર(રો) અને કાયદેસરના પ્રતિનિધિ(ઓ)નાં નામ	તારીખના રોજ બાકી લેણાં* રૂા.	િકમાન્ડ નોટિસ તારીખ	પઝેશન તારીખ ફીઝિક્લ/ સિમ્બોલીક	સ્થાવર મિલક્ત(તો) / સલામત અસ્કચામત(તો) નું વર્ણન
(એ)	(બી)	(સી)	(8)	(8)	(એફ)
q	શ્રી ગૌરવ અશોક સખારવાદે (બોરોઅર) શ્રીમતી ભાવના ગૌરવ સખારવાદે (કો-બોરોઅર)	રા. ૬,૩૬,૯૬૩/-, રા. ૧૫,૩૬૫/-, રા. ૩,૩૬,૫૮૪/- અને રા. ૨૮,૪૦૦/- અનુક્રમે ૩૧ ઓક્ટો. , ૨૦૨૩ ના રોજ°	રહ નવે., ૨૦૨૩	રર સપ્ટે., ૨૦૨૪ ફીઝિક્લ	ચુનિટ - બી/૧૧૩, પહેલો માળ, ગોકુલમ ફલેટ્સ, સ. નં. ૩૪૩/૨, એફપી - ૪૨/૨, ટીપી - ૮૯, સિગ્નેચર સમ્પદ સામે, ઉજાલા ચાર રસ્તા પારો, સરખેજ, અમદાવાદ - ૩૮૦૦૦૧.

" લાગુ પડતા વધારાના વ્યાજ સાથે, પ્રાસંગિક ખર્ચા, ચાર્જિસ વગેરે ચૂકવણી/જમા થાય ત્યાં સુધીના ગણાશે.

જો કે, અહીં ઉપર દર્શાવેલ બોરોઅર/કાયદેસરના વારસદાર(રો) અને કાયદેસરના પ્રતિનિધિ(ઓ) બાકી લેણી નીકળતી રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયેલ છે. તેથી આ સાથે ઉપરોક્ત બોરોઅર/ કાયદેસરના વારસદાર(રો) અને કાયદેસરના પ્રતિનિધિ(ઓ)ને વ્યક્તિગત રીતે અને જાહેરે જનતાને સૂચના આપવામાં આવે છે કે, **એચડીએફસી**ના અધિકૃત અધિકારી/ઓ (ભૂતકાળમાં **એચડીએફસી લિ.** , જેનું નામદાર એનસીએલટી, મુંબઇના તારીખ ૧૭ માર્ચ, ૨૦૨૩ ના આદેશ મુજબ મંજૂર થયેલ એકીકરણ યોજના અનુસાર **એચડીએફસી બેન્ક લિમિટેડ** સાથે એકીકરણ થયેલ છે) દ્વારા ઉપરોક્ત એક્ટની કલમ ૧૩ (૪) હેઠળ અને ઉપરોક્ત નિયમના નિયમ-૮ સાથે વાંચતા મળેલ સત્તાને આધિન રહી, ઉપરોક્ત તારીખોએ અહીં ઉપર દર્શાવેલ સ્થાયી પ્રોપર્ટી/ સિક્યોર્ડ એસેટનો કબજો મેળવી લેવામાં આવેલ છે.

અહીં ઉપરોક્ત બોરોઅર/ કાયદેસરના વારસો અને કાયદેસરના પ્રતિનિધિ(ઓ) ને વ્યક્તિગત રીતે અને જાહેર જનતાને આ સાથે સાવધાન કરવામાં આવે છે કે ઉપરોક્ત સ્થાયી પ્રોપર્ટી/સિક્યોર્ડ એસેટ સાથેનો કોઇ સોદો કરાશે તો તે **એચકીએફસી બેન્ક લિમિટેક**ના ગિરો હક્કને આધિન રહેશે. બોરોઅર(ર્સ)/ કાયદેસરના વારસ (દારો), કાયદેસરના પ્રતિનિધિ(ઓ)નું ધ્યાન દોરવામાં આવે છે કે એકટની ક્લમ-૧૩ ની પેટા ક્લમ(૮) ની જોગવાઇ અનુસાર સમય રહેતાં પોતાની સલામત અસ્કયામત/તો છોડાવી લે.

કરવામાં આવેલ પંચનામું અને તૈયાર કરાયેલ ઇન્વેન્ટરી નીચે સહી કરનાર પાસે ઉપલબ્ધ છે; અને ઉપરોક્ત બોરોઅર(ર્સ)/ કાયદેસરના વારસદાર(રો)/ કાયદેસરના પ્રતિનિધિ(ઓ) ને વિનંતી છે કે તે નકલ નીચે સહી કરનાર પાસેથી કામકાજના દિવસોએ કામકાજના સમય દરમિયાન મેળવી

તારીખ : ૨૫-૦૯-૨૦૨૪

स्थल : समहावाह

લિટરનો ઘટાડો કરવામા આવી શકે છે. એજન્સીના જણાવ્યા અનુસાર,

ભારતમાં તહેવારોની સીઝન

શરૂ થઈ ગઈ છે, ત્યારે તે પહેલા

લોકોને રાહત મળી શકે છે. રેટિંગ

એજન્સી ઈક્રાએ ગુરુવારે કહ્યું કે,

હાલ કેટલાક મહિનામાં કાચા

તેલની કિંમતોમાં આવેલા ઘટાડાથી

પેટ્રોલિયમ કંપનીઓના વાહન

બળતણ પર નફામાં સુધાર આવ્યો

છે. તેનાથી સાર્વજનિક ક્ષેત્રની

કંપનીઓને પેટ્રોલ તથા ડીઝલની

કિંમતોમાં બે થી ત્રણ રૂપિયા પ્રતિ

તેલની કિંમત સપ્ટેમ્બરમાં અંદાજિત ૭૪ અમેરિકન ડોલર કેટલાક મહિનામાં કાચા

તેલની કિંમતોમાં આવેલા ઘટાડાથી પેટ્રોલિયમ કંપનીઓના વાહન બળતણ પર નફામાં સુધાર આવ્યો

પ્રતિ બેરલ હતી, જે માર્ચમાં ૮૩-૮૪ અમેરિકન ડોલર પ્રતિ બેરલ હતી. પેટ્રોલ અને ડીઝલની

યેયા પ્રતિ લિટરનો ઘટાડો થઈ પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ઈક્રાએ એક પ્રેસનોટમાં કહ્યું કે, કાચા તેલની કિંમતોમાં ઘટાડાની સાથે હાલના સપ્તાહમાં ભારતીય પેટ્રોલિયમ વિતરણ કંપનીઓ (ઓએમસી) માટે મોટર વાહન બળતણના વેચાણ પર નફામાં સુધાર આવ્યો

> રેટિંગ એજન્સીઓનું અનુમાન છે કે, જો કાચા તેલની કિંમતો વર્તમાન સ્તર પર સ્થિર રહે છે તો રિટેલ બળતણના કિંમતોમાં ઘટાડાની શક્ચતા રહેલી છે.

કોરીજેન્ડમ નોટિસ ૨૬મી વાર્ષિક સામાન્ય સભાના સંદર્ભમાં

નં .૭ના સમજૂતીત્મક નિવેદનમાં કરેલા સુધારા વધારા ધ્યાન પર લાવવા ઈચ્છે

સ્ટોક એક્સચેન્જની વેબસાઈટ <u>www.bseindia.com</u> અને www.nseindia.com ઉપર અને CDSL ની વેબસાઈટ <u>www.evotingindia.com</u> પર પણ ઉપલબ્ધ છે.





















19

Sellwin Traders Limited CIN: L51909WB1980PLC033018 Reg. Off.: 126/B Old China Bazar Street, Kolkata-700 001, Phone: +91 33 22313974& Corporate Office:Laram Centre, 208 A2 24, S V Road, Andheri (West) 400058, Contact No. +91 9714787932

E-mail: selltl_1980@yahoo.co.in, Website: www.sellwinindia.com **Notice of E-voting Information** Pursuant to Provisions of Section 108 of the Companies Act, 2013, Rule 20 of the

Companies (Management and Administration) Rules, 2014 as amended by the Companies (Management and Administration) Amendment Rules, 2015 and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is pleased to provide E-voting facility to the members to cast their votes electronically on all resolutions proposed to be considered at the Extra Ordinary General Meeting (EGM) to be held on Monday, 21st of October, 2024 at 12:00 p.m. through video conferencing and at any adjournment thereof. The Company has engaged the services of Central Depository Services (India) Limited (CDSL) to provide the e-voting facility. The e-voting facility is available at the link www.evotingindia.com. The details pursuant to the provisions of the Companies Act, 2013 and the Rules, are given here under:

(i) Date of completion sending of Notice of EGM: 26.09.2024

(ii) Date and time of commencement of "Remote e-voting": Friday, 18th October,

iii) Date and time of end of "Remote e-voting": Sunday, 20th October, 2024 at 05:00 P.M

(iv) Cut-off date for E-voting: Monday, 14th October, 2024 (v) Remote E-voting shall not be allowed beyond 05:00 P.M. on 20th October,

Any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the Notice and holding shares as of the cutoff date i.e. 14th October, 2024, may obtain the login ID and password by sending a request at helpdesk.evoting@cdslindia.com or selltl_1980@yahoo.co.in However, if you are already registered with CDSL for remote e-voting then you can use your existing user ID and password for

www.evotingindia.com or contact CDSL at the following toll free no.: The members who have casted their vote by remote e-voting prior to the EGM may also attend the EGM but shall not be entitled to cast their vote

casting your vote. If you forgot your password, you can reset your password by using Forgot User Details/Password option available on

The facility for venue voting shall be made available at the meeting and the members who have not casted their vote by remote e-voting shall be able to attend the EGM and vote by use of Venue Voting. Kindly take the same on record and acknowledge the receipt of the same.

By Order of the Board For Sellwin Traders Limited Date: 25.09.2024 MonilNavinchandraVora Place: Ahmedabad

Kiri Industries Limited

Regd. Office: 7th Floor, Hasubhai Chambers, Opp. Townhall,

Ellisbridge, Ahmedabad 380 006

Contact No: (P) +91 79 - 26574371/72/73, Fax: +91 79 - 26574374

Email ID: info@kiriindustries.com; Website: www.kiriindustries.com.

CORRIGENDUM TO THE NOTICE OF THE 26th ANNUAL GENERAL MEETING

KIRI INDUSTRIES LIMITED ("the Company") has issued the Notice dated August 29, 2024

("Notice") for convening the 26th Annual General Meeting ("AGM") of the members of the

Company which is scheduled to be held on Friday, September 27, 2024 at 11.00 A.M. (IST)

through Video Conferencing ("VC"). The Notice of the AGM has been dispatched on September

04, 2024 to the members of the Company in due compliance of the provisions of the

The Company through this Corrigendum to the Notice wishes to bring to the notice of the

members relating to certain changes in the Explanatory statement as set out in the Item no. 7

This Corrigendum to the Notice of the AGM regarding changes in the Explanatory Statement

shall form an integral part of the Notice of AGM dated August 29, 2024, which has already been

circulated to shareholders of Company and on and from the date hereof, the Notice of the AGM

shall always be read in conjunction with this Corrigendum. Except as detailed in the

The Corrigendum to the Notice is also available on website of the Company at www.kiriindustries.com, website of the stock exchanges at www.bseindia.com and

www.nseindia.com and website of the Central Depository Services India Limited ("CDSL") at

Corrigendum, all other terms and contents of the Notice shall remain unchanged.

Companies Act, 2013 read with the relevant rules made thereunder.

INDOSTAR CAPITAL FINANCE LIMITED

Registered Add: - Silver Utopia, Third Floor, Unit No 301-A, Opposite P & G Plaza, Cardinal Gracious Road. Chakala.

POSSESSION NOTICE

Rule 8(1) of Security Interest (Enforcement) Rules, 2002

Whereas the authorized officer of Indostar Capital Finance Ltd. registered office at Silver Utopia, Third Floor, Unit No 301-A, Opposite P & G Plaza, Cardinal Gracious Road, Chakala, Andheri (E), Mumbai – 400099, India, under the securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(2) read with rule 3 of the Security interest (Enforcement) Rules, 2002 Issued a Demand Notice calling upon the Borrower (S) / Co- Borrower (S) / Guarantor (S), to repay an amount mentioned in the notice schedule here in under.

The Borrower, the Co-Borrowers having failed to repay the amount in full, notice is hereby given to the borrower, Co borrower, Guaranton and the public in general that, the Authorized Officer has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Ordinance read with rule 8 of the said rules.

The Borrower, Co-Borrowers in particular the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of immovable property, their entire outstanding dues for the loan facilities availed and also for which securities have been created by them as detailed under :-

SL No	Name of the Borrower / Co-Borrower & Address	Description of the Schedule Property	Notice Date & Amount (S) Demanded
1. 2. 3.	MULTI BRAND OUTLET :SHOP NO 25 SR NO 44 MAHALAXMI VIHAR ALANDI ROAD VISHRANTWADI PUNE : 411015 MAHARASTRA ABHIJEET KISANRAO NALAWADE SUNDAR NIWAS SR. NO 84/2B SAI PARK, DIGHI PUNE : 411015 MAHARASTRA HARSHAL K NALAWADE FLAT NO. B-905, SR NO 82/7 KAMAL RAJ HARIDWAR WALKE NAGAR DIGHI PUNE : 411015 MAHARASHTRA. FORTREND LIFESTYLE PRIVATE LIMITED, PRIME DEVELOPERS, S NO 86 BL A/2 S NO 44 MAHALAXMI VIHAR, VISHRANTWADI, PUNE, MAHARASHTRA, 411015 ANUSHKA ABHIJEET NALAWADE, SUNDER NIWAS 84/2/B, PARK DIGHI, PUNE, MAHARASHTRA, 411015 NILAM HARSHAL NALAWADE, SUNDAR NIWAS, 84/2/B, SAI PARK,	All that part and parcel of the property bearing Shop No. 86 situated Ground Floor in the Building, " Mahalaxmi Vihar" S.N0 44a/1, CTS No: 50, Plot No 2 Vishrantwadi Dhanori Pune- 411015	16/07/2024 Rs. 1,41,48,693/- [Rupees One Crore Forty One lakhs Forty Eight Thousand Six Hundred and Ninety Three Only] Loan Account No. LSPUN05117-180001462
	DIGHI, PUNE, MAHARASHTRA, 411015		

Possession Date: 24/09/2024 **Authorized Officer** Place: Pune **Indostar Capital Finance Limited**

SBFC Finance Limited

SBFC Registered Office:- Unit No. 103, First Floor, C&B Square, Sangam Complex, Village Chakala, Andheri- Kurla Road, Andheri (East), Mumbai-400059.

POSSESSION NOTICE (As per Rule 8(2) of Security Interest (Enforcement) Rules, 2002)

Whereas the undersigned being the Authorized Officer of SBFC Finance Limited under the Securitization, Reconstruction of Financial

Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13 (12) read with Rule 8 of the Security Interest (Enforcement) rules 2002, issued Demand Notices upon the Borrowers/Co-borrowers mentioned below, to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. The borrower/Co-borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrower/Co-borrowers and the public in

general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/ her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the below-mentioned dates. The Borrower/Co-borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with

the property will be subject to the charge of SBFC Finance Limited.

Name and Address of Borrowers & Date of Demand Notice	Description of Property(ies) & Date of Possession	Amount demanded in Possession Notice (Rs.)
1. Sunil Anant Mahadik, 2. Sujata Sunil Mahadik, 3. Sahil Arvind Singh, Both are having address at Room No 2, Sai Krupa Chawl No 4, Ganesh Nagar, Rawalpada, Dahisar East, Near Highway Road, Mumbai Suburban, MUMBAI, MAHARASHTRA-400068. Demand Notice Date: 16th December 2022 Loan Account No. '05000036505DH PR00683329	All the piece and parcel of property bearing Survey No. 48, Hissa No. 3/2, admeasuring approximately 1000 Sq. Fts. i.e. 92.93 Sq. Mtrs. And the Construction on 2 Rooms admeasuring approximately 280 Sq. Fts. i.e. 26.02 Sq. Mtrs. Bearing Pimpri Chinchwad Municipal Corporation Property No. 04/32/158 (243/1(2)), standing thereon, situated at Village Rahatani, Taluka Haveli, District Pune, within the Registration District Pune and Sub Registration District Taluka Haveli and also within the limits of Pimpri Chinchwad Municipal Corporation. Date of Possession: 21rd September, 2024	Rs.2027731/- (Rupees Twenty Lacs Twenty Seven Thousand Seven Hundred Thirty One Only) as on 10th December 2022
1. Nilesh Bharat Khollam, 2. Shalan Bharal Khollam, 3. Swapnil B Khollam, all are having address at House No 304, 1st Floor, Near Someshwar Mandir, Janwadi, Pune, PUNE, MAHARASHTRA-411016. Demand Notice Date: 20th August 2021 Loan Account No. '01500015686DH PR00680096	All the piece and parcel of property bearing Office no. 333 admeasuring 83 sq. ft. i.e. 7.71 sq.mtrs.Carpet area in the building known as "Mahalakshmi Metro Square" Isituated at CTS No. 35 and 36 and 41, Haveli, Registration District Pune and within the limits of Pune Muncipal Corporation and bounded as under: East - By CTS No. 41, Budhwar Peth, South - By CTS no 21, Budhwar Peth, West - By Anand Ashram, North - By Muncipal Lane. Date of Possession: 21rd September, 2024	Rs.1664956/- (Rupees Sixteen Lakh(s) Sixty Four Thousand Nine Hundred Fifty Six Only) as on 19th August 2021.
1. Yuvraj Jayram Belhekar, 2. Mangal Yuvraj Belhekar, Both are having address at Sr No 47, Kalpataru Hsg Soc, Om Sai Bldg., Chandan Nagar, Pune, PUNE, MAHARASHTRA - 411014. Demand Notice Date: 07th March 2022 Loan Account No. 01500015576	All the piece and parcel of property bearing Apartment no. 102 admeasuring 937 sq feet i.e., 87 sq. meter, on the ground of the building known as Deoda Garden Apartments property being lying and situate within the registration Distrct Pune, Plot no 26 admeasuring 645.60 sq. meter as per sanctioned layout of Survey no 46, Hissa no 3-B of Vadgaon Sheri, Pune, bounded as East - by 40 feet wide internal road, West - By Plot no 25, North-By 40 feet wide internal Road, South - By Survey no 47,	Rs.7635644/- (Rupees Seventy Six Lakh(s) Thirty Five Thousand Six Hundred Forty Four Only) as on 26th February 2022

The Borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Date of Possession: 21rd September, 2024

Place: Pune Date: 27-9-2024 Sd/- (Authorized Officer), SBFC Finance Limited.

SBFC Finance Limited

SBFC Registered Office:- Unit No. 103, First Floor, C&B Square, Sangam Complex, Village Chakala, Andheri- Kurla Road, Andheri (East), Mumbai-400059.

POSSESSION NOTICE (As per Rule 8(2) of Security Interest (Enforcement) Rules, 2002) Whereas the undersigned being the Authorized Officer of SBFC Finance Limited under the Securitization, Reconstruction of Financial

Assets and Enforcement of Security Interest Act. 2002 and in exercise of the powers conferred under section 13 (12) read with Rule 8 of the Security Interest (Enforcement) rules 2002, issued Demand Notices upon the Borrowers/Co-borrowers mentioned below, to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice.

general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/ her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the below-mentioned dates.

The borrower/Co-borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrower/Co-borrowers and the public in

The Borrower/Co-borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with

Name and Address of Borrowers & Date of Demand Notice	Description of Property(ies) & Date of Possession	Amount demanded in Possession Notice (Rs.)
1. Veena Vijay Varvante 2. Vijay Venkat Warwante, Both are having same address Sr No 48/4, Ganesh Nagar, Wadgaon Sheri, Anand Park, PUNE, MAHARASHTRA-411014 Demand Notice Date: 24th November 2022 Loan Account No. '01500015760DH PR00680115	All the piece and parcel of property bearing Survey No. 48, Hissa No. 3/2, admeasuring approximately 1000 Sq. Fts. i.e. 92.93 Sq. Mtrs. And the Construction on 2 Rooms admeasuring approximately 280 Sq. Fts. i.e. 26.02 Sq. Mtrs. Bearing Pimpri Chinchwad Municipal Corporation Property No. 04/32/158 (243/1(2)), standing thereon, situated at Village Rahatani, Taluka Haveli, District Pune, within the Registration District Pune and Sub Registration District Taluka Haveli and also within the limits of Pimpri Chinchwad Municipal Corporation. Date of Possession: 20rd September, 2024	Rs.2919665/- (Rupees Twenty Nine Lakh(s Nineteen Thousand Six Hundred Sixty Five Only as on 21st November 2022
1. Ranjeet R Jagtap, 2. Kamal Raghunath Jagtap, All are having address at Flat No 3, A/3/ B, First Floor, Sr No 70, Bhapkar Buld Ganesh Ngr, New Sangvi, Opp Hotel Rajmudra, Pune, PUNE, MAHARASHTRA-411027. Demand Notice Date: 30th May 2022 Loan Account No. '01500015623DH	All the piece and parcel of property bearing Survey no 4, Hissa No 1/2/1, area admeasuring 92.93 sq meters i.e., 25.28 open land and constructed on the said land 728 sq feet i.e., 67.65 sq meters and on First floor 773 sq feet i.e. 71.84 sq meters and Second floor cement Tin Roof Bricks and Raw construction area admeasuring 773 sq feet i.e., 71.84 sq meters situated at Village Pimple Nilakh, Taluka HAveli, Dist - Pune, PCMC Property bearing no 0801846.00 and bounded as East - By 15 feet wide road, South - By Property of Mr. Kisan Maruti Kanase,	Thirty Eight Lakh(s) Ninety Seven Thousand

of Mr. Kisan Maruti Kanase. Date of Possession: 20rd September, 2024 All the piece and parcel of property bearing Flat no 7, in A- Rs.2576684/- (Rupees 1. Nilesh Arun Pharate, 2. Arun Building situated on the Second floor admeasuring about 600 Twenty Five Lakh(s) Vitthal Pharate,3, Sangeeta Arun Pharate, 4. Sayali Nilesh Pharate, All are having address at House No 47/3/328, Near Shivaji Chowk, Ganesh Nagar, New Sangavi, Pune, Pune , PUNE, MAHARASHTRA -411027.

PR00680085

Demand Notice Date: 30th May 2022

Loan Account No. '01500015388DH PR00680033

411041.

secured assets.

1. Amol Arun Kenjale, 2. Nitu Amol All the piece and parcel of property bearing Flat No. 4 on first Rs.2718461/- (Rupees Kenjale, Both are having address at Sr floor admeasuring 500 sq. ft. built up area i.e. 46. 46 sq.mtrs. Twenty Seven Lakh(s) No 64/3, Samrudhi Paradise, Flat No along with terrace admeasuring 80 sq. ft. built up i.e. 7.43 sq. Eighteen Thousand Four 04, Behind Trimurti Hospital, Dhayari mtrs.in the building known as "SAMRUDHI PARADISE" Hundred Sixty One Only) Phata, Pune, PUNE, MAHARASHTRA- developed on land proeprty admeasuring 5 acres, Bearign as on 26th February 2022 Survey No 64, Hissa No 3+4+6/1/1B/4 of Mouje Vadgaon Demand Notice Date: 07th March 2022 | Budruk, which land is situated within the limits of pune Loan Account No. '01500015789DH municipal corporation and within the Revenue Jurisdiction of Joint Sub Registrar, Haveli No 16, Pune & Which is bounded on

or Towards:- East - By Property of Shri Bhide of Survey no 64,

South - By Property of Shivtirth Apartment out of S No 64, West

By an Internal 10 feet Road, North - By Property of Shri

West - By Property of Mr. Maruti Balwadkar, North - By Property

city survey records of Village Sangavi, Tal - HAveli, Dist - Pune, 2022

which is bounded as East - By road, West - By Road, South - By

CTS No 2149, 2148 and 2147 and North - By CTS No 2141 &

Date of Possession: 20rd September, 2024

sq feets in built-up area, Property bearing S No 70, Hissa no Seventy Six Thousand

1/12 which also bears CTS No 2146 admeasuring about 00 Six Hundred Eighty Four

Hectare 10 ares as per 7/12 extract and 978.2 sq meters as per Only) as on 24th May

All capitalized terms used herein and not specifically defined shall have the same meaning as ascribed to them in the DRHP.

BOOK RUNNING LEAD MANAGERS

7th Floor, Cnergy Tel: +91 22 6630 3030 E-mail: mouritech.ipo@jmfl.com Investor grievance e-mail: grievance.ibd@jmfl.com

JM Financial Limited Appasaheb Marathe Marg, Prabhadevi Mumbai 400 025 Maharashtra, India

Website: www.jmfl.com Contact Person: Prachee Dhuri SEBI Registration No.: INM000010361 REGISTRAR TO THE OFFER **LINK** Intime

Link Intime India Private Limited C-101, 1st Floor, 247 Park

Lal Bahadur Shastri Marg, Vikhroli West Mumbai 400 083 Maharashtra, India Telephone: +91 810 811 4949

E-mail: mouritech.ipo@linkintime.co.in Investor grievance e-mail: mouritech.ipo@linkintime.co.in

Website: www.linkintime.co.in

Contact Person: Shanti Gopalkrishnan SEBI Registration No.: INR000004058

Chiranjeevi Raju Dharma

Company Secretary and Compliance Officer

MOURI TECH LIMITED is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to undertake an initial public offer of its Equity Shares and has filed the DRHP dated September 25, 2024 with SEBI and with the Stock Exchanges. The DRHP shall be available on the website of SEBI at www.sebi.gov.in, on the websites of the Stock Exchanges i.e., BSE at www.bseindia.com, NSE at www.nseindia.com, on the websites of the BRLMs, i.e. Nuvama Wealth Management Limited at www.nuvama.com, ICICI Securities Limited at www.icicisecurities.com and JM Financial Limited at www.jmfl.com and on the website of our Company at www.mouritech.com. Potential investors should note that investment in equity shares involves a high degree of risk and for details relating to such risk, see the section titled "Risk Factors" on page 33 of the DRHP, Potential investors should not rely on the DRHP filed with SEBI for making any investment decision,

The Equity Shares offered in the Offer have not been and will not be registered under the U.S. Securities Act of 1933, as amended (the "U.S. Securities Act") or any state securities laws in the United States, and unless so registered may not be offered or sold within the United States, except pursuant to an exemption from, or in a transaction not subject to, the registration requirements of the U.S. Securities Act and applicable state securities laws. Accordingly, such Equity Shares are being offered and sold (i) outside of the United States in offshore transactions in reliance on Regulation S under the U.S. Securities Act and the applicable laws of the jurisdiction where those offers and sales occur; and (ii) within the United States to "gualified institutional buyers" (as defined in Rule 144A under the U.S. Securities Act), pursuant to the private placement exemption set out in Section 4(a) of the U.S. Securities Act.

OFFER TO ACQUIRE, PURCHASE OR SUBSCRIBE TO SECURITIES UNDER THE SECURITIES AND EXCHANGE BOARD OF INDIA (ISSUE OF CAPITAL AND DISCLOSURE REQUIREMENTS) REGULATIONS, 2018, AS AMENDED ("SEBI ICDR REGULATIONS"). INITIAL PUBLIC OFFERING OF EQUITY SHARES ON THE MAIN BOARD OF THE STOCK EXCHANGES (AS DEFINED IN THE DRHP) IN COMPLIANCE WITH CHAPTER II OF THE SEBI ICDR REGULATIONS. NOT FOR RELEASE, PUBLICATION OR DISTRIBUTION DIRECTLY OR INDIRECTLY, OUTSIDE INDIA

www.evotingindia.com.

Date: September 26, 2024

Place: Ahmedabad

as detailed in the said Notice.

Code to view the DRHP)

MOURI TECH® **MOURI TECH LIMITED**

For Kiri Industries Limited

Suresh Gondalia

Company Secretary

THIS IS A PUBLIC ANNOUNCEMENT FOR INFORMATION PURPOSES ONLY AND IS NOT A PROSPECTUS ANNOUNCEMENT AND DOES NOT CONSTITUTE AN INVITATION OR

PUBLIC ANNOUNCEMENT

Our Company was incorporated on December 19, 2005, at Hyderabad, Andhra Pradesh, India as 'MOURI Soft Solutions Private Limited', a private limited company under the Companies Act, 1956, pursuant to a certificate of incorporation issued by the Assistant Registrar of Companies, Andhra Pradesh at Hyderabad. Our Board further approved the change in the name of our Company from 'MOURI Soft Solutions Private Limited' to 'MOURI Tech Private Limited by their resolution dated January 4, 2012, which was thereafter approved by the Shareholders through their special resolution dated January 25, 2012 and a fresh certificate of incorporation, under the Companies Act, 1956, was issued by the Registrar of Companies, Andhra Pradesh at Hyderabad on January 31, 2012. Thereafter our Company was converted to a public limited company pursuant to a special resolution passed by the Shareholders of our Company on June 6, 2024 and the name of our Company was changed to 'MOURI Tech Limited' and a fresh certificate of incorporation consequent upon conversion to a public limited company dated July 4, 2024 was issued by the Central Processing Centre, Manesar, For details of changes in our name and the Registered Office, see "History and Certain Corporate Matters - Brief history of our Company" and "History and Certain Corporate Matters - Changes in the registered office of our Company" on page 228. Registered Office: 6-3-83, 3rd floor, Loukya Towers, Mallampet Road, Bachupally, Hyderabad 500 090, Telangana, India.

Corporate Office: Vaishnavi's Iconic, SY No. 62, Unit 1A, 1" floor and Unit 4A, 4" floor, Madhapur, Hyderabad 500 081, Telangana, India; Contact Person: Chiranjeevi Raju Dharma, Company Secretary and Compliance Officer; Telephone: 040-67254104; E-mail: cs@mouritech.com; Website: www.mouritech.com; Corporate Identity Number: U72200TG2005PLC048486

OUR PROMOTERS: ANIL REDDY YERRAMREDDY AND SUJAI PATURU

INITIAL PUBLIC OFFERING OF [●] EQUITY SHARES OF FACE VALUE OF ₹ 10 EACH ("EQUITY SHARES") OF MOURI TECH LIMITED ("COMPANY" OR THE "ISSUER") FOR CASH AT A PRICE OF ₹ [●] PER EQUITY SHARE (INCLUDING A SHARE PREMIUM OF ₹ [+] PER EQUITY SHARE) (THE "OFFER PRICE") AGGREGATING UP TO ₹ 15,000 MILLION, COMPRISING A FRESH ISSUE OF [+] EQUITY SHARES AGGREGATING UP TO ₹ 4,400 MILLION ("FRESH ISSUE") AND AN OFFER FOR SALE OF [◆] EQUITY SHARES (THE "OFFERED SHARES") AGGREGATING UP TO ₹ 10,600 MILLION ,COMPRISING [◆] EQUITY SHARES BY SUJAI PATURU AGGREGATING UP TO ₹ 6.150 MILLION. [•] EQUITY SHARES BY ANIL REDDY YERRAMREDDY AGGREGATING UP TO ₹ 3.160 MILLION AND [•] EQUITY SHARES BY SRINIVASU RAO SANDAKA AGGREGATING UP TO ₹ 1,290 MILLION (COLLECTIVELY, THE "SELLING SHAREHOLDERS") AND SUCH EQUITY SHARES OFFERED BY THE SELLING SHAREHOLDERS ("OFFER FOR SALE", AND TOGETHER WITH THE FRESH ISSUE, THE "OFFER") THE OFFER WILL CONSTITUTE (*1% OF OUR POST-OFFER PAID-UP EQUITY SHARE CAPITAL, OUR COMPANY, IN CONSULTATION WITH THE BRLMS, MAY CONSIDER ISSUE OF SPECIFIED SECURITIES AS MAY BE PERMITTED UNDER THE APPLICABLE LAW, AGGREGATING UP TO ₹ 880 MILLION PRIOR TO FILING OF THE RED HERRING PROSPECTUS WITH THE ROC ("PRE-IPO PLACEMENT"). THE PRE-IPO PLACEMENT, IF UNDERTAKEN, WILL BE AT A PRICE TO BE DECIDED BY OUR COMPANY, IN CONSULTATION WITH THE BRLMS. IF THE PRE-IPO PLACEMENT, IF UNDERTAKEN, SHALL NOT EXCEED 20% OF THE SIZE OF THE FRESH ISSUE.

SECURITIES CONTRACTS (REGULATION) RULES, 1957, AS AMENDED ("SCRR"). PRIOR TO THE COMPLETION OF THE OFFER, OUR COMPANY SHALL APPROPRIATELY INTIMATE THE SUBSCRIBERS TO THE PRE-IPO PLACEMENT, PRIOR TO ALLOTMENT PURSUANT TO THE PRE-IPO PLACEMENT, THAT THERE IS NO GUARANTEE THAT OUR COMPANY MAY PROCEED WITH THE OFFER OR THE OFFER MAY BE SUCCESSFUL AND WILL RESULT IN LISTING OF THE EQUITY SHARES ON THE STOCK EXCHANGES. FURTHER, RELEVANT DISCLOSURES IN RELATION TO SUCH INTIMATION TO THE SUBSCRIBERS TO THE PRE-IPO PLACEMENT (IF UNDERTAKEN) SHALL BE APPROPRIATELY MADE IN THE RELEVANT SECTIONS OF THE RED HERRING PROSPECTUS AND PROSPECTUS. THE OFFER INCLUDES A RESERVATION OF [●] EQUITY SHARES, AGGREGATING TO ₹ [●] MILLION (CONSTITUTING [●]% OF THE POST OFFER PAID-UP EQUITY SHARE CAPITAL OF OUR COMPANY) FOR

IF THE PRE-IPO PLACEMENT IS COMPLETED, THE FRESH ISSUE SIZE WILL BE REDUCED TO THE EXTENT OF SUCH PRE-IPO PLACEMENT, SUBJECT TO THE OFFER COMPLYING WITH RULE 19(2)(B) OF THE

SUBSCRIPTION BY ELIGIBLE EMPLOYEES (THE "EMPLOYEE RESERVATION PORTION"). THE OFFER LESS THE EMPLOYEE RESERVATION PORTION IS HEREINAFTER REFERRED TO AS THE "NET OFFER" THE OFFER AND THE NET OFFER SHALL CONSTITUTE [●]% AND [●]%, RESPECTIVELY, OF THE POST-OFFER PAID-UP EQUITY SHARE CAPITAL OF OUR COMPANY, OUR COMPANY IN CONSULTATION WITH THE BOOK RUNNING LEAD MANAGERS, MAY OFFER A DISCOUNT OF UP TO [◆]% (EQUIVALENT OF ₹ [◆] PER EQUITY SHARE) TO THE OFFER PRICE TO ELIGIBLE EMPLOYEES BIDDING UNDER THE EMPLOYEE RESERVATION PORTION ("EMPLOYEE DISCOUNT").

THE FACE VALUE OF EQUITY SHARES IS \$10 EACH. THE OFFER PRICE IS [+] TIMES THE FACE VALUE OF THE EQUITY SHARES. THE PRICE BAND, THE MINIMUM BID LOT SIZE AND THE EMPLOYEE DISCOUNT (IF ANY) WILL BE DECIDED BY OUR COMPANY IN CONSULTATION WITH THE BRLMS AND WILL BE ADVERTISED IN ALL EDITIONS OF [•], AN ENGLISH DAILY NEWSPAPER, [•] EDITIONS OF [•], (A HINDI DAILY NEWSPAPER) AND ALL EDITIONS OF [*], (A TELUGU DAILY NEWSPAPER, TELUGU BEING THE REGIONAL LANGUAGE OF TELANGANA, WHERE OUR REGISTERED OFFICE IS LOCATED), EACH WITH WIDE CIRCULATION, AT LEAST TWO WORKING DAYS PRIOR TO THE BID/ OFFER OPENING DATE AND SHALL BE MADE AVAILABLE TO THE STOCK EXCHANGES FOR UPLOADING ON THEIR RESPECTIVE WEBSITES IN ACCORDANCE WITH THE SEBI ICDR REGULATIONS.

In case of any revision in the Price Band, the Bid/ Offer Period shall be extended for at least three additional Working Days after revision of the Price Band, subject to the total Bid/Offer Period not exceeding 10 Working Days. In cases of force majeure, strike or similar unforeseen circumstances, our Company in consultation with the BRLMs, for reasons to be recorded in writing, extend the Bid / Offer Period for a minimum of one Working Day, subject to the Bid/ Offer Period not exceeding 10 Working Days. Any revision in the Price Band, and the revised Bid/ Offer Period, if applicable, shall be widely disseminated by notification to the Stock Exchanges by issuing a public notice and also by indicating the change on the websites of the BRLMs and at the terminals of the Syndicate and by intimation to Self-Certified Syndicate Banks ("SCSBs") Designated Intermediaries and the Sponsor Bank(s), as applicable

The Offer is being made in terms of Rule 19(2)(b) of the Securities Contracts (Regulation) Rules, 1957, as amended (the "SCRR"), read with Regulation 31 of the SEBI ICDR Regulations. The Offer is being made through the Book Building Process and in accordance with Regulation 6(1) of the SEBI ICDR Regulations wherein not more than 50% of the Net Offer shall be available for allocation on a proportionate basis to Qualified Institutional Buyers ("QIBs") and such portion, (the "QIB Portion"), provided that our Company in consultation with the BRLMs may allocate up to 60% of the QIB Portion to Anchor Investors and the basis of such allocation will be on a discretionary basis, in consultation with the BRLMs, in accordance with the SEBI ICDR Regulations (the "Anchor Investor Portion"), of which one-third shall be reserved for domestic Mutual Funds, subject to valid Bids being received from the domestic Mutual Funds at or above the price at which allocation is made to Anchor Investors ("Anchor Investor Allocation Price"). In the event of under- subscription or non-allocation in the Anchor Investor Portion, the balance Equity Shares shall be added to the QIB Portion (other than the Anchor Investor Portion) (the "Net QIB Portion"). Further, 5% of the Net QIB Portion shall be available for allocation on a proportionate basis to Mutual Funds only, subject to valid Bids being received at or above the Offer Price, and the remainder of the Net QIB Portion shall be available for allocation on a proportionate basis to all QIBs (other than Anchor Investors), including Mutual Funds, subject to valid Bids being received at or above the Offer Price. Further, up to [●] Equity Shares aggregating to ₹[●] million will be available for allocation to Eligible Employees, subject to valid Bids being received at or above the Offer Price. Further, not less than 15% of the Net Offer shall be available for allocation to Non-Institutional Category") of which one-third of the Non-Institutional Category shall be available for allocation to Bidders with an application size of more than ₹ 0.20 million and up to ₹ 1.00 million and two-thirds of the Non-Institutional Category shall be available for allocation to Bidders with an application size of more than₹ 1.00 million and under-subscription in either of these two sub-categories of the Non-Institutional Category may be allocated to Bidders in the other sub-category of the Non-Institutional Category in accordance with the SEBI ICDR Regulations, subject to valid Bids being received at or above the Offer Price. Further, not less than 35% of the Net Offer shall be available for allocation to Retail Individual Investors ("Retail Category"), in accordance with the SEBI ICDR Regulations, subject to valid Bids being received from them at or above the Offer Price. All potential Bidders (except Anchor Investors) shall mandatorily participate in this Offer only through the Application Supported by Blocked Amount ("ASBA") process and shall provide details of their respective bank account (including UPIID (defined hereinafter) in case of UPI Bidders (defined hereinafter) in which the Bid Amount will be blocked by the Self Certified Syndicate Banks ("SCSBs") or pursuant to the UPI Mechanism, as the case may be. Anchor Investors are not permitted to participate in the Anchor Investor Portion through the ASBA process.

Pursuant to Regulation 26(1) of the SEBI ICDR Regulations, the DRHP filed with Securities and Exchange Board of India ("SEBI") shall be made available to the public for comments, if any, for period of at least 21 days, from the date of filing by hosting it on the website of SEBI at www.sebi.gov.in, on the websites of the Stock Exchanges i.e., BSE at www.nseindia.com, NSE at www.nseindia.com where the equity shares are proposed to be listed, the websites of the BRLMs, i.e. Nuvama Wealth Management Limited at www.nuvama.com, ICICI Securities Limited at www.infl.com and the website of our Company at www.mouritech.com. Our Company hereby invites the public to give their comments on the DRHP filed with SEBI, with respect to disclosures made in the DRHP. The members of public are requested to send a copy of their comments to SEBI, to the Company Secretary and Compliance Officer of our Company and/or the BRLMs at their respective addresses mentioned herein below. All comments must be received by SEBI and/or our Company and/or the BRLMs and/or the Company Secretary and Compliance Officer of our Company at their respective addresses mentioned herein below in relation to the Offer on or before 5:00 p.m. on the 21st day from the aforesaid date of filing the DRHP with SEBI, ivestments in equity and equity-related securities involve a degree of risk and Bidders should not invest any funds in the Offer unless they can afford to take the risk of losing their investment. Bidders are advised to read the risk

Further, Equity Shares will be allocated on a proportionate basis to Eligible Employees applying under the Employee Reservation Portion, subject to valid Bids received from them at or above the Offer Price. For details, see

factors carefully before taking an investment decision in the Offer. For taking an investment decision, Bidders must rely on their own examination of our Company and the Offer, including the risks involved. The Equity Shares in the Offer have neither been recommended, nor approved by the SEBI, nor does SEBI guarantee the accuracy or adequacy of the Contents of the Draft Red Herring Prospectus. Specific attention of the Bidders is invited to "Risk Any decision to invest in the Equity Shares described in the DRHP may only be made after the red herring Prospectus") has been filed with the RoC and must be made solely on the basis of such Red

Herring Prospectus as there may be material changes in the Red Herring Prospectus from the DRHP. The Equity Shares, when offered through the Red Herring Prospectus, are proposed to be listed on the main board of BSE and NSE.

For details of the main objects of the Company as contained in its memorandum of association, see "History and Certain Corporate Matters" on page 228 of the DRHP.

The liability of the members of the Company is limited. For details of the share capital, capital structure of the Company and the names of the signatories to the memorandum of association and the number of shares subscribed

by them see "Capital Structure" on page 93 of the DRHP.

nuvama Nuvama Wealth Management Limited

"Offer Procedure" on page 531 of the DRHP.

801-804, Wing A. Building No 3 Inspire BKC, G Block Bandra Kurla Complex, Bandra East Mumbai 400 051 Telephone: +91 22 4009 4400 Email: MouriTech@nuvama.com Investorgrievanceemail: customerservice.mb@nuvama.com

Website: www.nuvama.com

Place: Hyderabad

Date : September 26, 2024

Contact Person: Lokesh Shah

SEBI Registration No.: INM000013004

CICI Securities **ICICI Securities Limited**

ICICI Venture House, Appasaheb Marathe Marg, Prabhadevi, Mumbai - 400 025. Maharashtra, India Telephone: +91 22 6807 7100 Email: mouritech.ipo@icicisecurities.com Investorgrievanceemail: customercare@icicisecurities.com Website: www.icicisecurities.com

SEBI Registration No.: INM000011179

A JM FINANCIAL

Contact Person: Namrata Ravasia / Harsh Thakkar

For MOURI TECH LIMITED On behalf of the Board of Directors

financialexp epaprin

Sd/- (Authorized Officer), SBFC Finance Limited.

Place: Pune Date: 27-9-2024

Date of Possession: 20rd September, 2024

The Borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the

PArkhe.

Andheri (E), Mumbai – 400099, India (CIN-L24231GJ1998PLC034094)

Farmer Fill of Colores